



ઘી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સમૃદ્ધિ", ૪થો માળ, મક્કાઈ પુલ, નાનપુરા, સુરત - ૩૯૫ ૦૦૧

ફોન નં. ૨૨૯૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

રેફ નં.

તા : ૨૬/૪/૨૦૨૧

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(ડે. સેક્રેટરી)

**ભગવાન તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે, એટલા માટે
દર સો વર્ષે કોઈને કોઈ વાયરસ મોકલીને કુદરતની જાળવણી
કરવા લોકોને સમજાવે છે : સંજય રાવલ**

ચેમ્બર દ્વારા સંજય રાવલ સાથે 'તમે કેમ છો?' વિશે વેબિનાર યોજાયો

સુરત. ઘી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ 'તમે કેમ છો?' વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વક્તા તરીકે સંજય એમ.એસ. એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના સંજય રાવલે લોકોને કોરોનાની પરિસ્થિતિમાં મજામાં કેમ રહેવું? તેના વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

સંજય રાવલે જણાવ્યું હતું કે, તમે કેમ છો? એવું કોઈ પુછે તો કહેજો કે હું મજામાં છું અને જીવન ખૂબ જ સુંદર છે. પરંતુ આવું કોઈ કહેતું નથી. અત્યારે આપણં બધું ધ્યાન કોરોના ઉપર જ છે. એનામાં લોકો સાજા થઈને જાય છે તેના પર કોઈનું ધ્યાન જ જતું નથી. જો કે, લોકોએ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે. કોરોનાથી બચવા માટે ડોક્ટરો અને સરકારે બધાને સમજાવ્યા હતા પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડ્યા હતા. કોવિડ- ૧૯ પોઝીટીવ આવે એટલે લોકોનું બ્લડ પ્રેશર ઘટે છે અને ગભરાઈને હાર્ટએટેકથી જ મરી રહ્યા છે. આથી લોકોએ મજામાં જ રહેવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કામ-ઘંઘો બંધ કરવાની જરૂર નથી. કોરોના જવાનો નથી. જિંદગી ગમે તેટલી હેરાન કરે પણ તેને કેવી રીતે રિએક્ટ કરવી તે આપણા હાથમાં છે. અત્યારના કપરા સમયમાં પ્રિકોશનના ભાગરૂપે બધાએ કોરોનાથી બચવા માટે વેક્સીન લેવી જોઈએ. રોગ ઉપર ધ્યાન આપવાને બદલે એના નિદાન ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પોતાની આદતો અને ખાનપાન બદલવું પડશે. સામાન્ય ખોરાકમાંથી પણ બધા જ વિટામિન અને પ્રોટીન મળી જાય છે. રૂટીન મસ્ત રીતે ચાલુ રાખો પણ બને એટલા ઓછા લોકોને મળો. કોઈને મળવાનું થાય તો માસ્ક પહેરો. ડરવાનું નથી, મજામાં રહેવાનું છે. આવક ઓછી થાય તો તેમાં કરકસર કરતા શીખી જવું. મોતની સામે પણ હસતા હસતા લડવાનું છે. વલી મેથી યુવાનોને પણ તુરંત જ વેક્સીન લઈ લેવાનો આગ્રહ તેમણે કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એ સોલ્યુશન નથી. પરીક્ષાથી શું કામ ભાગવું જોઈએ? અત્યારે સમય જોઈને નિર્ણય લેવા જોઈએ. ભાગેડ વૃત્તિ અથવા પલાયન પ્રવૃત્તિ સારી વાત નથી. અત્યારે પ્રશાસન કે સરકારની સામે આક્રોશ કરવાનો સમય નથી. લોકોએ કોઈને ક્રીટીસાઈઝ કરવાની જરૂર નથી. આપણા હાથમાં જે હોય છે તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ. ચૂંટણી આવે ત્યારે લોકોએ જે યોગ્ય લાગે તે જવાબ આપવો જોઈએ. દેશના સાધુ-સંતોએ લોકોને સાચું જીવન જીવવાનું યોગ્ય રીતે બતાવ્યું છે. એટલા માટે જ આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવીત છે. “કોઈના ગુનાને તું બેનકાબ ના કર, ઇશ્વર બેઠો છે તું હિસાબ ના કર.” પૃથ્વી પર જ બધો હિસાબ થવાનો છે. રૂપિયા આપીને જવાના છે અથવા તો મુકીને જવાના છે, પરંતુ મૃત્યુ બાદ રૂપિયા પોતાની સાથે ઉપર લઈ જવાના નથી એ વાત લોકોએ સમજવી જોઈએ.

ભગવાન પણ મજામાં હશે? તેવા સવાલના જવાબમાં સંજય રાવલે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે લોકો ટપોટપ મરી રહ્યા છે તેને કારણે ભગવાન મજામાં નહીં પણ દુઃખી હશે પણ પૃથ્વી ઉપર બેલેન્સ કરવા માટે તેઓ મજબૂર હશે. આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી છે. પાણીનો બગાડ કરી રહ્યા છે અને ખૂબ ઝાડો કાપી નાંખ્યા છે. વિદેશમાં એક લાખ ઝાડ કાપવા હોય તો તેના દસ વર્ષ પહેલા એક લાખ ઝાડ ઉગાડવા પડે છે. પરંતુ આપણે ત્યાં રસ્તા બનાવવાના નામે તેમજ મોર્ડનાઈઝેશનના નામે વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. જેને કારણે અત્યારે ઓકસીજન માટે વલખા મારવાની નોબત આવી છે. મનુષ્યએ આખી પૃથ્વી ઉપર પ્લાસ્ટીક ફેલાવી દીધું છે. એટલા માટે જ આપણે પ્લાસ્ટીકમાં આવી ગયા છે. તેમણે કહ્યું કે, ભગવાન પણ તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે. એટલા માટે દર સો વર્ષે કોઈને કોઈ વાયરસ મોકલીને લોકોને કુદરતની જાળવણી કરવા માટે તેમજ કુદરતને પ્રેમ કરવા માટે સમજાવે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જે કોઈ ખોટું કામ કરશે એ ભોગવશે. હરામનો કમાયેલો એક રૂપિયો પણ જે તે વ્યક્તિની સંતાનને રીબાઈ રીબાઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એમાં એ વ્યક્તિની સંતાનનો કોઈ વાંક પણ ન હોય તેમ છતાં તેઓને ભોગવવાનો વારો આવે છે. આ બાબત લોકોએ સમજવી જોઈએ. કારણ કે, દરેક કર્મની લેન-દેન પૂર્ણ થતી હોય છે એવું ધર્મગ્રંથો કહે છે. અત્યારના સમયે કેટલાક લોકોએ પાંચ રૂપિયાના માસ્ક ૫૦ રૂપિયામાં વેચ્યા છે અને એક - એક લાખ રૂપિયા લઈને ઇન્જેક્શનો આપ્યા છે. ઇન્જેક્શનના અભાવે દર્દીનું મોત થયાનું ડોક્ટરો કહી રહ્યા છે, પરંતુ કેટલાક ડોક્ટરો એવા પણ છે કે જે આ ઇન્જેક્શનની અસર માત્ર પાંચ-દસ ટકા જેટલી જ હોવાથી તેના અભાવે જ દર્દી મૃત્યુ પામે છે એ બાબત ખોટી હોવાનું જણાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પાંચ ટકા ડોક્ટરો જ એવા છે કે જેઓ માનવતા છોડીને ઘંઘો કરી રહ્યા છે પણ ૯૫ ટકા ડોક્ટરો દર્દીઓની સેવા કરી રહ્યાં છે.

કેટલાક અંગત મંતવ્યો આપતા સંજય રાવલે જણાવ્યું હતું કે, સરકારે બગીચા અને જીમ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ નહીં. બગીચા અને જીમ કરતા મોટી સંખ્યામાં લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એકત્રિત થાય છે. આથી નિયમો પ્રમાણે ચા-નાસ્તાની લારીઓ, થિયેટર, બગીચા અને જીમ વિગેરે ચાલુ રાખવાની સરકારે મંજૂરી આપવી જોઈએ. કારણ કે, લોકોનો બિઝનેસ અને રોજગાર અટવાઈ રહ્યો છે. બધાની રોજીરોટી ચાલુ રહે તેવા પ્રયત્ન અથવા તેવી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ. આપણે ત્યાં એસેસમેન્ટ વગર નિયમો બનાવી દેવામાં આવે છે અને બાદમાં પસ્તાવવાનો વારો આવે છે.

અપેક્ષા વિશે તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિએ કોઈના પ્રત્યે અપેક્ષા રાખવી જોઈએ નહીં. પોતાનું કામ જાતે જ કરી લેવું જોઈએ. પોતાનાથી થાય એટલું તો વ્યક્તિએ જાતે કરવું જ જોઈએ. બીજાની અપેક્ષા રાખ્યા વગર પણ વ્યક્તિ કામ કરતો થઈ જાય ત્યારે તેનામાં પાવર આવી જાય છે અને તેથી તે મજામાં રહી શકે છે. જેટલું જાતે થાય તેટલું કરવાની કોશિષ કરવી જોઈએ. અપેક્ષા વગર જીવવું અને કોઈથી અપેક્ષા નહીં રાખવું એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

ઓનલાઇન વિશે તેમણે કહ્યું હતું કે, ઓનલાઇન એ ગતકડું છે પણ ભવિષ્ય નથી. પરોક્ષને બદલે પ્રત્યક્ષમાં જે આનંદ અને સંતોષ છે તે ઓનલાઇનમાં નથી. વિદ્યાર્થીઓને સ્કૂલમાં ગયા બાદ જે વાતાવરણ મળે છે તે ઓનલાઇન ભણતરમાં ક્યારેય નહીં મળી શકે. સ્કૂલમાં જ વિદ્યાર્થીનું ઘડતર પણ થાય છે. પણ અત્યારે જ્યારે આખી દુનિયા ઓનલાઇનનો ઉપયોગ કરી રહી છે ત્યારે સમયના વહેણમાં આપણે પણ વહેવું જોઈએ પણ ઓનલાઇન એ પરમનન્ટ સોલ્યુશન નથી.

પોતાની એક્ટીવિટી વિશે તેમણે કહ્યું હતું કે, અત્યારના સમયમાં સૌથી વધુ મારી જાત સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરું છું. સેલ્ફ એનાલિસિસ કરી રહ્યો છું અને લખવાનું શરૂ કર્યું છે. આપણે મરી ન જઈએ એના માટે પોલીસ મારતી હતી તે વિશે લખી રહ્યો છું. મહિનામાં ૨૨-૨૪ દિવસ સેમિનાર કરતો હોવાથી ઘરેથી બહાર જ રહેતો હતો પણ અત્યારે ઘરમાં પરિવારજનો સાથે રહું છું એટલે મારા માટે જીવનનો ગોલ્ડન પિરિયડ છે.

વધુમાં તેમણે કહ્યું કે, પૃથ્વી ઉપર આપણે ચોકકસ કોઈ કારણ માટે આવ્યા છીએ. એટલે શા માટે આવ્યા છીએ તે ચકાસવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે જે ૨૦ સ્કીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી ૨૦ સ્કીલનો અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યો છું. પોતાની સ્કૂલ અને યુનિવર્સિટીનું કામ કરી રહ્યો છું. અંતે તેમણે કહ્યું કે, જરાય ડરવું નથી અને ગભરાવવું નહીં. મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું.

ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.